



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ,
છક્કો માળ, ગિફ્ટ વન, માર્ગ-૫-સી, ઝોન-૫,
ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨ ૩૫૫, ગુજરાત.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ સમક્ષ,
ગાંધીનગર

નીચેની બાબતો અંગે,

આયોગ દ્વારા જાહેર કરાયેલ ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(રિન્યુબલ સંસાધનોમાંથી વિજળીની પ્રાપ્તિ)ના વિનિયમો ૨૦૧૦ તથા સમયાંતરે કરાયેલ સુધારાના અનુસંધાને ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ દ્વારા રાજ્યના વિતરણ પરવાનેદારોના વર્ષ ૨૦૧૮-૧૯ ના RPO ના અમલીકરણની ચકાસણી માટે સ્વયં અરજી નં ૧૮૪૭/૨૦૧૯ શરૂ કરાઈ છે.

જાહેર નોટિસ

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ, RPO ના પાલન માટે ૨૦૧૮-૧૯ નાણાકીય વર્ષની તેની ટકાવારીની સુધારણા માટે દાખલ કરેલ અરજી નં ૧૮૦૮/૨૦૧૯ આયોગને મળી છે, ઉક્ત અરજીમાં, આયોગે તેના તા.૨૩.૧૦.૨૦૧૯ના હુકમ અન્વયે સ્ટેક હોલ્ડરો પાસેથી અભિપ્રાય અને સુચનો મંગાવવાનું નક્કી કર્યું હતું.

આયોગે ઉપર્યુક્ત હુકમ અને અરજી અન્વયે, રાજ્યના વિતરણ પરવાનેદારો દ્વારા RPO ના અમલીકરણની ખરાઈ કરવા સ્વયં કાર્યવાહી શરૂ કરવા અને વિતરણ પરવાનેદાર કસૂરના કેસમાં કોઈ હોય તો સંબંધિત કસૂરવાર વિતરણ પરવાનેદારો જેમકે એસ્પેનપાર્ક ઇન્ફ્રા વડોદરા પ્રાઇવેટ લિમિટેડ, એમપીએસઇઝેડ યુટિલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ, એસ્પેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, જુબિલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, ગિફ્ટ પાવર કંપની લિમિટેડ તથા ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(નોડલ એજન્સી) સામે જોગવાઈઓ અનુસાર લેવાં જરૂરી પગલાં નક્કી કરવાનો નિર્ણય છે. જે મુજબ, આયોગ દ્વારા સ્વયં અરજી નં ૧૮૪૭/૨૦૧૯ તૈયાર કરવામાં આવેલ છે. જે આયોગની વેબસાઇટ www.gercin.org ઉપર મુકવામાં આવેલ છે.

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ(કારોબારીનું સંચાલન) વિનિયમો ૨૦૦૪ અનુસાર, અહીં જાહેર કરવામાં આવે છે કે, ઉપરની સ્વયં કરાયેલી અરજીના સંબંધમાં જેમને તેના વાંધા/સુચનો રજૂ કરવામાં રસ હોય તેવી વ્યક્તિઓ, તેઓ જેના પર આધાર રાખવા માંગતા હોય તે એફિડેવિટથી યોગ્ય રીતે સમર્થિત દસ્તાવેજો સાથે તા.૧૦/૦૧/૨૦૨૦ પહેલા સચિવશ્રી, ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, છક્કો માળ, ગિફ્ટ વન, માર્ગ ૫-સી, ઝોન ૫, ગિફ્ટ સીટી, ગાંધીનગર-૩૮૨૩૫૫, ગુજરાત ને રજૂ કરી શકશે અને તેઓની રૂબરૂમાં સાંભળે તેમ તેઓ ઇચ્છે કે કેમ તે પણ તેમાં દર્શાવે. સ્વયં કરાયેલી અરજી નં ૧૮૪૭/૨૦૧૯ માટેની સુનાવણીની તારીખ ૧૬/૦૧/૨૦૨૦ ના રોજ ૧૧:૩૦ વાગ્યે નક્કી કરી છે.

આ અંગેની વધારાની માહિતી આયોગની વેબસાઇટ www.gercin.org પર ઉપલબ્ધ છે.

ગાંધીનગર
તા.૦૬/૧૨/૨૦૧૯

સહી/-
(રૂપવંત સિંહ, આઇ.એ.એસ)
સચિવ
જી.ઈ.આર.સી.